

## હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, દાહોદ દ્વારા “હલકા ધાન્ય તેમજ ડાંગરના પાકોની વૈજ્ઞાનિક ખેતી અંગેની એક દિવસીય કેન્દ્રીય ખેડૂત તાલીમ કાર્યક્રમ” યોજાયો

હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર , આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ , દાહોદ તેમજ સદગુરૂ ફાઉન્ડેશનના ઉપક્રમે “ સ્ટ્રેન્ધનીંગ ઓફ એગ્રી. પોલીક્લીનીક ફોર ટ્રાયબલ ફાર્મર્સ એટ દાહોદ”ની યોજના અંતર્ગત તારીખ ૦૩ જુલાઈ, ૨૦૧૭ ના રોજ “ કોદરાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી તેમજ નાગલી અને ડાંગરનું વૈજ્ઞાનિક ઢબે ધરૂવાડીયા ઉછેર પધ્ધતી અંગેની એક દિવસીય કેન્દ્રીય ખેડૂત તાલીમ કાર્યક્રમ ”ના વિષય પર આદિવાસી ખેડૂતો માટે આયોજીત કરવામાં આવેલ જેમા આદિવાસી ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ તેમજ કર્મચારીઓ મળીને ૩૫થી વધુ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ સમારોહની શરૂઆતમાં ડો. એસ. એ. ચૌહાણ, રિસર્ચ એસોસીએટ, હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, દાહોદ દ્વારા ઉપસ્થિત આદિવાસી ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ, કર્મચારીઓ અને ભાગ લેનાર સૌનુ હાર્દીક સ્વાગત કર્યુ હતુ. સદર કેન્દ્રીય તાલીમમાં દાહોદ જિલ્લાના નવાગામ અને રોઝમ ગામના આદિવાસી ખેડૂતોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. સદર ઉદબોધનમાં ડો. વાય. બી. ચૌહાણ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકશ્રી એ એગ્રી. પોલીક્લીનીક યોજનાની માહિતી, મગની જાત (ગુજરાત આણંદ મગ- ૫), કોદરાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી, નાગલી તેમજ કોદરામાં રહેલા પોષક તત્વો અને દાહોદ જિલ્લાના મુખ્ય પાકોમાં રોગ નિયંત્રણ વિશે માહિતગાર કર્યા હતા. જ્યારે ડો. એસ. એ. ચૌહાણ, રિસર્ચ એસોસીએટે, નાગલીમાંથી બનતી વિવિધ મૂલ્ય વર્ધિત બનાવટો વિશે, સંકલિત ખેતી પધ્ધતી તથા મોબાઈલ એપ્લીકેશન “ i-khedut ” અને ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવા માટે આગ્રહ કર્યો હતો. શ્રી એમ. પી. રામાણી, ખેતી અધિકારી એ ડાંગરનું વૈજ્ઞાનિક ઢબે ધરૂવાડીયા ઉછેર પધ્ધતી, ડાંગરની જુદી જુદી જાતો, ડાંગરના પાકની નિંદણ નિયંત્રણ તેમજ ખાતર વ્યવસ્થાપણ વિશે માર્ગદર્શન આપ્યું હતુ. કુ. શીતલબેન, ખેતી અધિકારી એ નાગલીનું વૈજ્ઞાનિક ઢબે ધરૂવાડીયા ઉછેર પધ્ધતી અને કુપોષણ સામે નાગલી તેમજ કોદરાની અગત્યતા વિશે ભાર મુકયો હતો. તેમજ શ્રી આરીફ શેખ, રિસર્ચ એસોસીએટ એ કૃષિ પાકોમાં જૈવિક પ્રવાહીની ઉપયોગીતા અને દાહોદ જિલ્લાના મુખ્ય પાકોમાં જીવાત નિયંત્રણના વિષય પર માહિતીથી માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમનું સંચાલન ડો. એસ. એ. ચૌહાણ અને શ્રી આરીફ શેખ, રિસર્ચ એસોસીએટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સફળ બનાવવા માટે કેન્દ્રના અન્ય વૈજ્ઞાનિક તેમજ કર્મચારી ડો. પાલી, શ્રી

એચ. જી. રાહોડ, શ્રી મહેશભાઈ પરમાર અને શ્રીમતી વીણાબેન ઉપસ્થિત રહેલ હતા. ડૉ. એસ. એ. ચૌહાણ, રિસર્ચ એસોસીએટ દ્વારા કાર્યક્રમને અંતે આભારવિધિ કરવામાં આવેલ હતી

## ફોટોગ્રાફ



નાગલી અને ડાંગરનું ધરૂવાડીયા વિશે ખેડૂતોને પ્રત્યક્ષ માર્ગદર્શન આપતા વૈજ્ઞાનિક  
ડૉ. વાચ. એમ. ચૌહાણ અને શ્રી એમ.પી. રામાણી

